

2020-21 શાળા-વર્ષ માટે વ્યક્તિગત શિક્ષણ યોજનાઓ (IEPs)નો પ્રથમ ડ્રાફ્ટ, વિદ્યાર્થીના ઇમેઇલ એકાઉન્ટ્સ (student#@pdsb.net)ને ઇમેઇલ કરવામાં આવશે. એવિમેન્ટરી વિદ્યાર્થીઓ, જો લાગુ પડતું હશે તો, તેમના IEP 22 ઓક્ટોબરના રોજ મેળવશે.

ઇમેઇલ્સ reportcards@peelsb.com પરથી મોકલાશે અને તેમાં એન્ક્રિપ્ટેડ સંદેશ સામેલ હશે, જે ખોલવાની સૂચના વિદ્યાર્થીઓને આપવામાં આવશે. એન્ક્રિપ્ટેડ સંદેશ એક સલામત અને સુરક્ષિત વિતરણ પદ્ધતિ છે જે વિદ્યાર્થીઓની ગુમતાનું રક્ષણ કરે છે. જે પરિવારોને તેમના બાળકના વિદ્યાર્થી ઇમેઇલ એકાઉન્ટને પ્રાપ્ત કરવામાં મદદની જરૂર હોય, તેઓને તેમના બાળકના શિક્ષકનો સંપર્ક કરવા અથવા તેમની [શાળાને ઇમેઇલ email their school](#) કરવા વિનંતી છે.

જો તમે તમારા બાળકના IEP વિષે ચર્ચા કરવા માગતા હો, તો કૃપા કરીને શાળા-વર્ષ દરમિયાન શિક્ષક દ્વારા માન્ય કરવામાં આવેલી સંપર્ક-સંવાદની પદ્ધતિનો ઉપયોગ કરીને તમારા બાળકના શિક્ષકનો સંપર્ક કરો.

તમારા IEPને પ્રાપ્ત કરવા માટેની સૂચનાઓ

એકવાર તમે ઇમેઇલ પ્રાપ્ત કરી લો, પછી નીચે આપેલ [instructions outlined/](#) સૂચનાઓને અનુસરો (અનુવાદો પણ નીચે આપેલ છે):

1. **પ્રથમ પગલું** - બાળકના સ્કૂલ જીમેઇલ એકાઉન્ટ (student#@pdsb.net): byod.peelschools.org નો ઉપયોગ કરીને મુખ્ય BYOD પેઇજ પર લોગઇન કરો
2. **બીજું પગલું** -તમારા બાળકના [BYOD page](#) પર જીમેઇલના લાલ અને સફેદ નિશાન પર ક્લિક કરો. *નોંધ – તમારા બાળકના શિક્ષક તરફથી મળતા રહેલા ઇમેઇલ કરતાં આ જુદી પદ્ધતિ હોઇ શકે છે.*
3. **ત્રીજું પગલું** -એક વાર તમે જીમેઇલ એપ્લિકેશન ખોલશો, એટલે તમારા ઇનબોક્સમાં તમે એક ઇમેઇલ reportcards@peelsb.com તરફથી આવેલો જોશો
4. **ચોથું પગલું** - જ્યારે તમે ઇમેઇલ ખોલો, ત્યારે તે ઇમેઇલ એડ્રેસ તમારા બાળકના સંપર્કોની યાદીમાં ઉમેરવાથી શરૂઆત કરો. *ઇમેઇલ પર ક્લિક કરવાથી તમે એમ કરી શકશો (ક્યારેક જમણી ક્લિકનો ઉપયોગ કરવાથી, ક્યારેક ડાબી –બેઉનો પ્રયાન કરવો).*
5. **પાંચમું પગલું** - એક વાર તમે ઇમેઇલ એડ્રેસને તમારા સંપર્કોમાં ઉમેરી દેશો, એટલે તમારા ઇમેઇલના મથાળે તમે પીળા રંગના ચોરસમાં *Be careful with this message* શિર્ષકવાળી સુચના જોશો. આગળ વધવા માટે "Looks safe" બટન ઉપર ક્લિક કરો.
6. **છઠ્ઠું પગલું** -ઇમેઇલ સાથે જોડવામાં આવેલ ફાઇલ ઉપર ક્લિક કરવાની જરૂર પડશે – આ જોડાણ "Encrypted Email" તરીકે ઓળખાય છે અને તેમાં તમારું IEP સમાવિષ્ટ હશે. એ સુરક્ષિત જોડાણને ખોલો. *કૃપા કરીને નોંધ લેશો કે કેટલાંક ઇન્ટરનેટ બ્રાઉઝર્સ અને/અથવા કોમ્પ્યુટર્સ આ ફાઇલને ખોલતા અગાઉ તેને ડાઉનલોડ કરવા વિનંતી કરી શકે છે.*
7. **સાતમું પગલું** - એકવાર તમે એ જોડાણ પર ક્લિક કરશો, એટલે તમને "Registered Envelope Service" શિર્ષકવાળો સ્ક્રિન દેખાવો જોઇએ. આ સ્ક્રિન વિદ્યાર્થીનું ઇમેઇલ એડ્રેસ પણ દેખાડશે. કૃપા કરીને "Open" બટન પર ક્લિક કરો. *કૃપા કરીને નોંધ લેશો કે "Open" બટન દેખાય તે પહેલાં તમારે કદાચ થોડીક મિનિટ રાહ જોવી પડે. એ પેઇજ લોડ થાય તે માટે કૃપા કરીને રાહ જુઓ અને "refresh" બટનને ક્લિક ના કરશો.*

8. **આઠમું પગલું** - એકવાર તમે “Open” ક્લિક કરશો, એટલે એ તમને Encrypted Email પર લઈ જશે જેમાં તમારું IEP હશે. તમને IEP ઇમેઇલમાં પીડીએફ ફોર્મેટમાં મળશે.

વિદ્યાર્થીઓ પાસે નીચેના વિકલ્પો હોય છે:

- સંદેશા સાથે જોડેલ પીડીએફને ડાઉનલોડ કરીને તમારા કોમ્પ્યુટરમાં સાચવી લો.
- આ એન્ક્રિપ્ટેડ સંદેશાને આગળ રવાના કરો – કૃપા કરીને ધ્યાન રાખજો કે તમારા IEPની માહિતી કોની સાથે સહિયારી કરો છો અને જરૂર પડે તો, એ ફક્ત તમારાં માતાપિતા કે વાલીને જ આગળ રવાના કરવી જોઈએ. ઇમેઇલને આગળ રવાના કરવા માટે આ પેઇજની જમણી બાજુએ આવેલા તીર પર ક્લિક કરો – કૃપા કરીને નોંધ લેશો કે જો તમે ઇમેઇલ આગળ રવાના કરશો તો તે એક એન્ક્રિપ્ટેડ સંદેશા તરીકે જશે.
- એકવાર કામ પતી જાય પછી કૃપા કરીને વિન્ડો બંધ કરવાનું યાદ રાખશો.

કૃપા કરીને નોંધ લેશો કે IEP ધરાવતા ઇમેઇલ્સ તમારા બાળકના સ્કૂલ જીમેલ એકાઉન્ટ પર મોકલવામાં આવશે - તે બ્રાઇટસ્પેસ (Brightspace) અથવા સીસો (Seesaw) સહિતના અન્ય પ્લેટફોર્મ દ્વારા મોકલવામાં આવશે **નહીં**.